

બિન સરકારી અનુદાનિત માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અરજી કરતી વખતે લોગ ઇન કરતી વખતે ધ્યાને લેવા અંગેની સૂચનાઓ

- <https://gserc.in/> વેબસાઇટ પર જઈ બિન સરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારે “[Apply for Higher Secondary Grant-in-aid](#)” પર ક્લિક કરવું તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારે “[Apply for Secondary Grant-in-aid](#)” પર ક્લિક કરવું.
- ત્યારબાદ પ્રથમ આપે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે આપની સ્ક્રીન પર દેખાતા [Not registered yet!! Click here to register](#) ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે.
- તેના પર ક્લિક કરતા આપે પોતાનો **TAT No, Date of Birth, Email Id, Mobile Number, Password, Confirm Password, Captcha** નાખવાના રહેશે.
- આપ જે **Password** રાખવા ઇચ્છતા હોય તે **Password** રાખી શકશો અને તે જ **Password** આપે **Confirm Password** માં નાખવાનો રહેશે. દાત. તરીકે આપ 123 **Password** રાખવા ઇચ્છતા હોય તો **Password** માં જઈ 123 નાખી **Confirm Password** માં પણ 123 નાખવાનું રહેશે.
- ત્યારબાદ **Verify Mobile Number** પર ક્લિક કરવાની રહેશે. ક્લિક કરતા આપે જે મોબાઇલ નંબર નાખેલ હશે તે નંબર પર OTP આવશે મોબાઇલ નંબર પર આવેલ OTP નાખતા આપનું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.
- રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ આપે અરજી ફોર્મ ભરવા માટે ફરીથી લોગ-ઇન કરવાનું રહેશે. તે માટે આપે **TAT No, Date of Birth, Password**(આપે જે રજીસ્ટ્રેશન સમયે રાખેલ છે તે), **Captcha** નાખવાનો રહેશે.
- આપે રજીસ્ટ્રેશન સમયે જે **Password** નાખ્યો હશે તે સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક જ રહેશે.